CIN: L40106GJ2014PLC081036 GST: 24AAVCS0328R1ZN



Date: 02-09-2023

To, Manager - Listing Compliance National Stock Exchange of India Limited 'Exchange Plaza'. C-1, Block G, Bandra Kurla Complex, Bandra (E), Mumbai - 400 051

**Script Code: SOLEX** 

**Dear Sir** 

Sub: - Newspaper Advertisements - Notice of 09th Annual General Meeting (AGM) and evoting information

Please find attached herewith copies of newspaper advertisements published in the Financial Express (English) and Gujarat Samachar (Gujarati), both newspapers having electronic editions, regarding notice of 9th Annual General Meeting and e-Voting information in terms of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of Companies (Management and Administration) Rules, 2014 (as amended) and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015

The above information is also available on the website of the Company www.solex.in.

Thanking you,

Yours faithfully,

For, Solex Energy Limited

DILIPKUMAR 555 NIKHARE P

GAJANAND S=Gujarat, SERIALNUMBER=FF4899C860024FE 5C58A553EA032CE762E442BE20CE B0991E744287814C5A5FA, CN=DILIPKUMAR GAJANAND NIKHARF

Dilipkumar G. Nikhare **Company Secretary & Compliance Officer** 

**Encl: As Above** 

CORP. OFFICE

## **NARBHERAM & CO. LIMITED**

CIN: L70101WB1930PLC006742 Regd. Office: Diamond Chambers, 4, Chowringhe Unit No. 9E, Block III, Kolkata - 700 016 Phone No.: +91 9831167447; email - info@narbheram.com

NOTICE IS HEREBY GIVEN that the 92nd Annual General Meeting (AGM) of the Company will be held on Wednesday, September 27, 2023, at 12:30 p.m. at the Registered Office of the Company at Diamond Chambers, 4, Chowringhee Lane, Unit No. 9E, Block Ill, Kolkata - 700 016, to transact the business as mentioned in the Notice of AGM sen along with the Audited Financial Statements, of the Company for the year ended March 31, 2023, and the Board's Report and Auditors Report thereon

Dispatch of the Annual Report 2023, along with the AGM Notice, Attendance Slip and Proxy Form, has been completed on September 1, 2023. The Notice of AGM is also available on the website of Central Depository Services (India) Limited (CDSL), i.e www.evotingindia.com. Notice is further given that the Company is providing electronic voting facility from a place other than the venue of AGM ('remote e-voting') to the members to exercise their votes on all the resolutions set forth in the Notice of AGM. The company has engaged CDSL for providing e-voting facility. The details of remote e-voting are

- (i) The remote e-voting will commence on, Sunday, September 24. 2023 from 9.00 A.M. and ends on Tuesday, September 26, 2023 till 5.00 P.M. The e-voting module sha be disabled for voting thereafter, and no one shall be allowed to vote electronically
- after September 26, 2023 (5:00 P.M.).

  (ii) The voting rights of Members shall be in proportion to their share of the paid-up
- share capital of the Company as on the cut-off date i.e. September 20, 2023.

  (iii) Notice of AGM has been sent to all the members whose names appeared in the Register of Members/Beneficial Owners as on August 25, 2023. Any person who acquires equity shares of the Company and becomes a Member after August 25 2023, and holding shares as on the cut-off date i.e. September 20, 2023, may obtain the Login ID and Password by sending a request at info@narbheram at Tel: +91 9831167447
- (iv) Once a vote is cast by the Member, he shall not be allowed to change it subsequent (v) The facility of casting vote through ballot paper will be made available at the AGN and the eligible members attending the AGM shall be able to cast their vote at AGM
- (vi) The Members who cast their vote by remote e-voting may also attend the AGM but shall not be entitled to cast their vote again.

In case of any queries pertaining to e-voting, members may refer to the Frequently Asket Questions (FAQs) and e-voting user manual for members available at the Downloads section of www.evotingindia.com or contact Mr. Mehboob Lakhani, CDSL, 17th Floor Phiroze Jeejeebhoy Towers, Dalal Street Fort, Mumbai - 400001, at email helpdesk.evoting@cdslindia.com. Telephone No.: 022-22725040.

NOTICE IS ALSO HEREBY GIVEN that pursuant to Section 91 of the Companies Act 2013, that the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Thursday, September 21, 2023 to Wednesday, September 27 2023 (both days inclusive)

For NARBHERAM & CO. LIMITED (JAY PRAFUL KAMANI

MANAGING DIRECTOR

(DIN - 00581816

Place: Kolkata Date: 01-09-2023

HEXA

**HEXA TRADEX LIMITED** CIN - L51101UP2010PLC042382

Regd. Office: A-1, UPSIDC Indl. Area, Nandgaon Road, Kosi Kalan, Distt, Mathura (U.P.)-281403

Corp. Office: Jindal Centre, 12, Bhikaiji Cama Place, New Delhi- 110066

Notice is hereby given that the 12th Annual General Meeting (AGM) of the Company will be held on Friday, 29th September, 2023 at 02:00 P.M. at the registered office of the Company at A-1 UPSIDC Industrial Area, Nandgaon Road, Kosi Kalan, District Mathura-281403. (U. P.) to ansact the business as set out in the Notice convening the said Annual General Meeting. As per various amended circulars issued by MCA and SEBI from time to time. Notice of the AGM along with the Annual Report 2022-23 is being sent through electronic mode to those Members whose email addresses are registered with the Company/Depositories and physical copies to all other members whose email addresses are not registered with the Company/Depositories. Members may note that the Notice and Annual Report 2022-23 will also be available on the Company's website www.hexatradex.com, websites of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively. The Annual Report 2022-23 alongwith Notice is being sent to the members holding shares on cut- off date 25th Augus

Notice is also hereby given that pursuant to section 91 of the Companies Act, 2013 and regulation 42 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members and Share Transfer Books of the Company shall remain closed from 23rd September, 2023 to 29th September, 2023 (both days inclusive) for the purpose of AGM.

Further, pursuant to the provisions of section 108 of the Companies Act, 2013 read with rul 20 of Companies (Management and Administration) Rules, 2014 and regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is providing remote e-voting facility to its members to cast their vote electronically on the esolutions to be transacted at 12th AGM of the Company. The member please note the followings:

- The remote e-voting shall commence at 9.00 a.m. on Tuesday, 26th September, 2023 and shall end at 5.00 p.m. on Thursday, 28th September, 2023.
- The remote e-voting shall not be available beyond 5.00 p.m. on Thursday, 28
- September, 2023. The cut-off date for determining the eligibility of members for remote e-voting and voting through poll at AGM is 22<sup>nd</sup> September, 2023.
- Any person who becomes member of the Company after dispatch of notice of the meeting and holding shares as on cut-off date i.e. 22<sup>nd</sup> September, 2023, may obtain their user id and password by contacting M/s. RCMC Share Registry (Pvt.) Ltd., R & T Agent of the Company at B-25/1, 1st Floor, Okhla Industrial Area Phase II, New Delhi – 110020, phone-011-36020465/66, Email-sectshares@rcmcdelhi.com
- The members who cast their vote through remote e-voting may also attend the AGM but shall not be allowed to cast their vote at AGM.
- The facility of voting through poll shall be available at the AGM to those members when the facility of voting through poll shall be available at the AGM to those members when the facility of voting through poll shall be available at the AGM to those members when the facility of voting through poll shall be available at the AGM to those members when the facility of voting through poll shall be available at the AGM to those members when the facility of voting through poll shall be available at the AGM to those members when the facility of voting through poll shall be available at the AGM to those members when the facility of voting through poll shall be available at the AGM to those members when the facility of voting through poll shall be available at the AGM to those members when the facility of voting through the voting through the facility of voting through the voting th have not casted their vote through remote e-voting.
- Members may go through the e-voting instructions provided in the AGM Notice or vis https://evoting.nsdl.com and in case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for members and e-voting User Manual for members available at the download section of https://evoting.nsdl.com

For Hexa Tradex Limited

Place: New Delhi Date: 01.09.2023

Pravesh Srivastava Company Secretary



HINDUSTAN Registered Office: Peninsula Business Park "A" Tower, 8th Floor, Senapati Bapat Marg, Lower Parel, Mumbai - 400 013. Tel.: (022) 6688 0100, Fax: (022) 6688 E-mail: hcl@hindcompo.com, Website: www.hindcompo.com

#### NOTICE OF 59th ANNUAL GENERAL MEETING **OF HINDUSTAN COMPOSITES LIMITED**

NOTICE is hereby given that, the 59<sup>th</sup> Annual General Meeting ('AGM') of the Members of Hindustan Composites Limited ('Company') will be held on **Friday**, **29**<sup>th</sup> **September**, **2023 at 11.45 a.m. (IST)** through Video Conferencing ('VC') / Other Audio-Visual Means ('OAVM') in compliance with the provisions of the Companies Act, 2013 ('Act') and Rules made thereunder and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with all applicable circular issued by the Ministry of Corporate Affairs ('MCA') and the Securities and Exchange Board of India ('SEBI') without physical presence of the Members at a commor venue to transact the business as set out in the Notice of the 59° AGM dated 30° June, 2023.

In accordance with the applicable MCA and SEBI Circulars, the Notice of the 50<sup>th</sup> AGM along with the Annual Report for the Financial Year 2022-23 will be sent through electronic mode only to those Members, whose e-mail addresses are registered with the Company / Registrar and Share Transfer Agents ('RTA') / Depository Participants. The requirement of sending physical copies of the Annual Report has been dispensed with vide said MCA and SEBI Circulars. Members can join and participate in the 59<sup>th</sup> AGM through VC/OAVM facility only. The instructions for joining the 59<sup>th</sup> AGM and the manner of participation in the remote e-voting or casting vote through e-voting system during the 59<sup>th</sup> AGM are provided in the Notice of the 59<sup>th</sup> AGM dated 30<sup>th</sup> June, 2023. In accordance with the applicable MCA and SEBI Circulars, the Notice of the 59

AGMiddled 30 Julie, 2025.

The Members attending the meeting through VC/OAVM facility shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013. The Notice of the 50° AGM along with Annual Report will also be available on the Company's website viz. <a href="https://www.himidcompc.com">www.himidcompc.com</a>, website of Central Depository Services (India) Limited ("CDSL") viz. <a href="https://www.votingindia.com">www.votingindia.com</a> and on website of Stock Exchanges (BSE Limited and National Stock Exchange of India Limited) at viz. www.bseindia.com and www.nseindia.com respectively

The Company has fixed Friday, 22<sup>nd</sup> September, 2023 as 'Cut-off date' for determining entitlement of members for attending the 59<sup>th</sup> AGM, e-voting and payment of fina dividend for the financial year ended 31<sup>st</sup> March, 2023, if approved at the 59<sup>th</sup> AGM. Members may note that as per the income tax Act, 1961, as amended by Finance Act, 2020, dividend paid after 1" April, 2020 shall be taxable in the hands of the Members and the Company shall be required to deduct the tax at source (TDS) at the prescribed rates from the Dividend. The TDS rates would vary depending on the residential status of the Members and the documents submitted by them within the time and accepted by the Company.

In case the Company is unable to pay the dividend to any shareholder through electronic mode due to non-availability of the details of the bank accounts, the Company shall dispatch the dividend warrant / demand draft by post.

In case a member has not registered his / her e-mail address, Mobile Number and Bank Account details with the Company / RTA / Depository Participant, he / she can follow below instructions for registration of his/her e-mail id for obtaining Annual Report and logic details for experience. Report and login details for e-voting:

Physical Holding Shareholders holding share in physical mode can Register / update their e-mail ID, Mobile Number and Bank Account details by furnishing the said details in Form ISR-1 and other relevant form(s) prescribed by SEBI with the Company's Registrar and Transfer Agent, Link Intime India Private Limited at C-101, 247 Park, L.B.S. Marg, Vikhroli (West), Mumbai -400083 or by sending an email at rnt.helpsdesk@linkintime.co.in The said Forms are available on the website of Company's RTA a https://web.linkintime.co.in/KYC-downloads.html

Shareholders holding shares in the Demat mode can update their e Holding mail ID, Mobile Number and Bank details with their respective Depository Participant.

The members will have an opportunity to cast their vote remotely and during the 59" AGM on the business as set forth in the Notice of the 59" AGM through the electronic voting system. The manner of remote e-voting and e-voting during the 59" AGM are provided in the Notice of the 59" AGM.

All grievances connected with the facility for voting by electronic means may be addressed to Mr. Rakesh Dalvi, Sr. Manager, (CDSL) Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or send an applied by held of the control of email to helpdesk.evoting@cdslindia.com or call toll free no. 1800 22 55 33.

For Hindustan Composites Limited

Place: Mahad

Date: 02/09/2023

Place: Mumbai Ravi Vaishnav Date : 01st September, 2023 Company Secretary & Compliance Officer

## AUTO LINE **AUTOLINE INDUSTRIES LIMITED**

CIN: L34300PN1996PLC104510

Reg. Office: Survey Nos. 313,314, 320 to 323, Nanekarwadi, Chakan, Tal: Khed, Dist. Pune 410 501 | Tel No. +91-2135 635865/6 Website: www.autolineind.com | Email: investorservices@autolineind.com

#### NOTICE

NOTICE is hereby given that the 27th Annual General Meeting ("Meeting") of the members of Autoline Industries Limited ("The Company") will be held on Monday, September 25, 2023 at 2:30 p.m. through Video Conferencing ("VC")/ other Audio Visual Means ("OAVM") in accordance with General Circular No. 10/2022 dated December 28, 2022 read together with General Circular Nos.20/2020 dated May 5, 2020 and General Circular No. 02/2022 dated May 5, 2022 and the rules made thereunder and other applicable circulars issued by the Ministry of Corporate Affairs (collectively referred to as 'MCA Circulars') and circulars issued by the Securities and Exchange Board of India (SEBI) (together referred to as "Circulars") to transact the business as set out in the Notice of the Meeting (Notice).

The Notice of 27th AGM and Annual Report 2022-23 will be sent electronically, in due course, to all those members, whose email addresses are registered with the Company or Registrar and Share Transfer Agents or their respective Depository Participants. The Notice of the 27th AGM and Annual Report will also be available on the website of the Company at www.autolineind.com and on the websites of the Stock Exchanges, i.e. BSE Limited & National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively, and on the website of NSDL at www.evoting.nsdl.com.

The manner in which the members holding shares in physical form or who have not registered their email addresses with the company can cast their vote through remote e-voting or through the e-voting system during the meeting will be provided in the Notice of the 27th AGM.

#### Manner of registering/updating email addresses:

- 1. In case shares are held in physical mode, please provide updated email address along with Folio No., Name of Shareholder, scanned copy of the share certificates (front & back ), PAN (self-attested scanned copy of PAN Card, AADHAR (self-attested scanned copy of Aadhar Card) by Email to investorservices@autolineind.com
- In case shares are held in demat mode, please provide your updated email id with your depositories.

Members may please note that the remote e-voting period will commence on Friday, September 22, 2023 (9:00 A.M. IST) and ends on Sunday, September 24, 2023 (05:00 PM IST). Further details will be provided in the Notice of meeting and members are requested to carefully read the instructions and information as will be set out in the Notice of the Meeting

By order of the Board For Autoline Industries Limited

Place: Pune Dated: 1st September 2023

Shilpa Walunj Company Secretary Membership No. A38259



## JITF INFRALOGISTICS LIMITED

CIN NO.: L60231UP2008PLC069245 Registered Office: A-1, UPSIDC Indl. Area, Nandgaon Road, Kosi Kalan, Distt. Mathura - 281403, India

Website: www.jindalinfralogistics.com, E-mail: contactus@jindalinfralogistics.com

### NOTICE OF THE 16<sup>™</sup> ANNUAL GENERAL MEETING

Notice is hereby given that the 16th Annual General Meeting ("AGM") of the Company will be neld on Friday, 29th September, 2023 at 02.30 P.M. at the registered office of the Compan at A-1, UPSIDC Industrial Area, Nandgaon Road, Kosi Kalan, District Mathura-281403, (U P.) to transact the business as set out in the Notice convening the said Annual General eeting. The Notice of AGM along with Annual Report for the Financial Year ended 31 March, 2023 has been sent to the members who hold shares as on record date, i.e., 25 ugust, 2023, by email, whose email id is registered with the Company/Depository(s) and the physical copy to all the other members. The said documents can also be viewed on the empany's website at <u>www.jindalinfralogistics.com</u>.

Notice is also hereby given that pursuant to section 91 of the Companies Act, 2013 and regulation 42 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015, the Register of Members and Share Transfer Books of the Company shall remain closed from 23rd September, 2023 to 29th September, 2023 (both days inclusive) for the urpose of AGM.

Further, pursuant to the provisions of section 108 of the Companies Act, 2013 read with rule 20 of Companies (Management and Administration) Rules, 2014 and regulation 44 of SEB (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is providing remote e-voting facility to its members to cast their vote electronically on the resolutions to be transacted at 16th AGM of the Company.

- he member please note the followings: The remote e-voting shall commence at 9.00 a.m. on Tuesday, 26th September, 2023
- and shall end at 5.00 p.m. on Thursday, 28th September, 2023. The remote e-voting shall not be available beyond 5.00 p.m. on Thursday, 28'
- The cut-off date for determining the eligibility of members for remote e-voting an voting through poll at AGM is 22nd September, 2023.
- Any person who becomes member of the Company after dispatch of notice of th meeting and holding shares as on cut-off date i.e. 22<sup>nd</sup> September, 2023, may obtain the user id and password by contacting RCMC Shares Registry (Pvt.) Ltd., R & T Agent of the Company at B-25/1, Okhla Industrial Area Phase II, New Delhi – 110020, phone 011-26387320-21, Fax-011-26387322, Email- evoting.services@rcmcdelhi.com.
- The members who cast their vote through remote e-voting may also attend the AGM but shall not be allowed to cast their vote at AGM.
- The facility of voting through poll shall be available at the AGM to those members who have not casted their vote through remote e-voting.
- Members may go through the e-voting instructions provided in the AGM Notice or visit https://evoting.nsdl.com\_and\_in\_case\_of\_anv\_queries\_vou\_may\_refer\_the\_Frequently Asked Questions (FAQs) for members and e-voting User Manual for member available at the download section of https://evoting.nsdl.com

For JITF Infralogistics Limited

Place: New Delhi Date: 01.09.2023

Alok Kuma Company Secretary ACS-19819

#### **CAPROLACTAM CHEMICALS LIMITED** (CIN: L24110MH1988PLC049683)

Regd. Office: B-31 MIDC, Industrial Area Mahad Raigarh, Maharashtra 402301 E-mail: caprolactam@gmail.com, website: www.caprolactam.co.in

### NOTICE OF 34<sup>™</sup> ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION

Annual General Meeting (AGM) of the Company will be he on Monday, 25th September, 2023 at 11:00 a.m. through Video Conference (VC) / Other Audio visual Means (OAVM) to transact the business, as set out in the Notice AGM. The Company has sent the Notice of AGM on Saturday, 02 September, 2023 through electronic mode to Member whose email addresses are registered with the Company/Depositories in accordance with the circular issued by Ministry of Corporate Affairs dated May 5, 2020 read with circulars dated April 8 2020 and April 13, 2020 (collectively referred to as "MCA Circulars") and SEBI Circular dated Ma 12, 2020. The Annual Report for Financial Year 2022-23 is available and can be downloaded from he Company's website http://caparolactam.co.in.and.the website of Central Securitie epository Limited (CSDL) www.evotingindia.com. In compliance with Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration Rules, 2014, as amended from time to time and Regulation 44 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015, the Member are provided with the facility to ast their votes on all resolutions set forth in the Notice of the AGM using electronic voting systems. e-voting) provided by CSDL. The voting rights of Members shall be in proportion to the equity shares held by them in the paid –up equity share capital of the Company as on Monday, 18t September, 2023 ('cut -off date'). The remote e-voting period commences on 21<sup>st</sup> Septembe 2023 (9:00 a.m.) and ends on 24" September, 2023 (5:00 p.m.). During this period, Members ma cast their vote electronically. The remote e-voting module shall be disabled by CSDL thereafter hose Members, who shall be present in the AGM 'through VC/OAVM facility and had not cas neir votes on the Resolutions through remote e-voting and are otherwise not barred from doin so shall be eligible to vote through remote e-voting system during the AGM. The Members wh have cast their votes by remote e-voting prior to the AGM may also attend/participate in the AGM hrough VC/OAVM shall not be entitled to cast their votes again. Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after the Notice has been sen electronically by the Company, and holds shares as of the cut-off date; may obtain the login ID an assword by sending a request to helpdesk.evoting@cdslindia.com. However, if he/she is eady registered with CSDL for remote e-voting then he/she can use his/her existing User and password for casting the votes. In compliance with the General Circular numbers 20/2020 4/2020, 17/2020 and all other applicable laws and circulars issued by the Ministry of Corpora Affairs (MCA), Government of India and Securities and Exchange Board of India (SEBI ectronic copies of the Notice of the AGM and Annual Report for fiscal 2023 will be sent to all th hareholders whose email addresses are registered with the Company/Depository Participant(s Shareholders holding shares in dematerialized mode, are requested to register their ema addresses and mobile numbers with their relevant depositories through their depositar articipants. Shareholders holding shares in physical mode are requested to furnish their ema ddresses and mobile numbers with the Company's Registrar and Share Transfer Agent Purv Sharegistry (I) Pyt, Ltd. at support@puryashare.com. The notice of the 34th AGM and Annual Repo or fiscal 2023 will also be made available on the Company's website, at www.caprolactam.co.i stock exchange websites and on the CSDL's website, at https:/www.evoting.csdl.com. For detail elating to remote e-voting, please refer to the Notice of the AGM.

If you have any queries or issues regarding attending AGM & e-Voting from the CDSL e-Votin System, you can write an email to helpdesk.evoting@cdslindia.com or contact at 022-2305873 and 022-23058542/43/ or contact at toll free no. 1800 22 55 33 All grievances connected with th acility for voting by electronic means may be addressed to Mr. Rakesh Dalvi, Sr. Manager CDSL) Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex Mafatlal Mill Compounds. N M Joshi Marg. Lower Parel (East), Mumbai - 400013 or send an ema helpdesk.evoting@cdslindia.com or call or contact at toll free no. 1800 22 55 33. The details of the AGM are available on the website of the Company at www.caprolactam.co.in, CSDL a ww.evoting.cdsl.com, BSE Limited at www.bseindia.com

For Caprolactam Chemicals Limited Managing Directo DIN - 00663374 SOLEX ENERGY LIMITED CIN: L40106GJ2014PLC081036

Registered Office: PLOT NO. 131/A, PHASE 1 NR. KRIMY INDUSTRIES, GIDC VITHAL UDYOGNAGAR, ANAND - 388121 Phone : +91 261 355 9999 Email: info@solex.in Website: www.solex.

video Conference ("VC") /Other Audio-Visual means ("OAVM") to transact the business as set out in the Notice of the 09th AGM, which is being circulated fo convening the AGM. The Company has already dispatched the Annual Report for the financial year 2022-23 along with the Notice convening 09th AGM, through electronic mode to the Shareholders whose email addresses are registered with the Company and / or Depositories in accordance with the Circulars issued by the Ministry of Corporate Affairs and Securities and Exchange Board of India. The Annual report along with the Notice of 09th AGM also available on the website of the Company at www.solex in and on the website of National Depository Services

Remote e-voting and e-voting during AGM Pursuant to the provisions of Section 108 of the Act and Rule 20 of the NSDL. The voting rights of Shareholders shall be in proportion to the equity shares

The remote e-voting period commences on Tuesday, 26th September, 2023 at 9:00 a.m. IST and will end on Thursday, 28th September, 2023 at 5:00 p.m. IST. During this period, the Shareholders may cast their vote electronically. The remote e-voting modules shall be disabled by NSDL thereafter. Those Shareholders, who shall be present in the 09th AGM through VC/OAVM facility and had not cast their votes on the resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system during the 09th AGM. The Shareholders who cast their votes by remote e-voting prior to the AGM may also attend/participate in the AGM through VC/OAVM but shall not be entitled to cast

The Registrar of Members and Share Transfer Books shall remain closed from 23/09/2023 to 29/09/2023 (both days inclusive) to determine entitlement of the Shareholders to receive Dividend for the Year 2022-23 and for the purpose of 9th Annual General Meeting.

Any person, who acquires shares of the Company and becomes a Shareholder of the Company after the Notice has been sent electronically by the Company, and holds shares as on the cut-off date; may obtain the login ID and password by

Frequently Asked Questions ("FAQs") and the e-voting manual available at ww.evoting.nsdl.com/, under help section or contact at 022 - 4886 7000 and 022 -2499 7000 or send a request at evoting@nsdl.co.in.

The details of AGM are available on the website of the Company at India Limited at www.nseindia.com.

Place : Anand Date : 02/09/2023

Dilipkumar Nikhare Company Secretary & Compliance Officer

## **BLB LIMITED**

NOTICE OF 42ND ANNUAL GENERAL MEETING AND REMOTE E-VOTING INFORMATION

ear Member(s),

NOTICE is hereby given that the 42<sup>nd</sup> Annual General Meeting (AGM) of the members of M/s. BLB Limited (Company) will be convened on Tuesday, September 26, 2023 at 12:30 p.m. (IST) via Video Conference ("VC")/ Other Audio Visual Means ("OAVM") <u>ONLY</u> to transact the businesses as set out in the Notice of the 42<sup>nd</sup> AGM, in Affairs ('MCA Circulars') and Circular dated May 12, 2020, January 15 2021, May 13, 2022 and January 5, 2023 issued by the Securities and Exchange Board of India ('SEBI Circulars')

The venue of 42<sup>nd</sup> AGM shall be deemed to be the Registered Office of the Company. Members participating through VC/ OAVM shall be reckoned for the purpose of quorum. Since this AGM is being held pursuant to the MCA and SEBI Circulars through VC/ OAVM, the

inancial Year 2022-23 have been sent in electronic mode only to nose members whose e-mail addresses are registered with the Company/ Registrar and Share Transfer Agent (RTA).The electronic dispatch of Notice of 42<sup>nd</sup> AGM and Annual Report for F.Y. 2022-23

ousinesses to be transacted at the AGM and for this purpose, the Company has appointed National Securities Depository Limited (NSDL), to facilitate voting through electronic means.

The details as required pursuant to the Act and Rules are as unde

- The remote e-voting period will commence at 09:00 a.m. (IST) on Saturday, September 23, 2023 and shall end at 05:00 p.m. (IST) on Monday, September 25, 2023. The remote e-voting module will be disabled by the NSDL thereafter and members will not be allowed to vote electronically beyond the said date and time. The voting rights of the Members shall be in proportion to the
- share of the paid-up equity share capital of the Company as or Tuesday, September 19, 2023 ('Cut-Off Date'). The facility of remote e-voting shall also be made available during the Meetin and the Members attending the Meeting, who have not alread cast their vote by remote e-voting shall be able to exercise their right during the Meeting. A person whose name is recorded in the Register of Members/ Register of Beneficial Owners as on th Cut-Off Date only shall be entitled to avail the facility of remote e
- to NSDL at evoting@nsdl.co.in or may contact at 022 488 7000. A person who is not a Member as on the cut-off date shoul treat the Notice of the AGM for information purpose only
- The Members who have already cast their votes by remote voting prior to the AGM will have right to participate at the AGM but shall not be entitled to cast their votes again on such resolution(s) for which the Member has already cast the vote through remote e-voting prior to the AGM. Once the member cast vote ona

e-voting during the AGM is provided in the notice for 42nd AGM Members who need assistance before or during the AGM, car contact NSDL at 022 - 4886 7000 and 022 - 2499 7000 or contact Ms. Snehal Bhame, Assistant Manager, NSDL, at designated e-mail ID: <u>evoting@nsdl.co.in</u>.

an update/ register their contact details including the details of e-ma ids by submitting the requisite Form ISR-1 along with supportin Members who have not registered their e-mail ID may get the same

registered/ updated with Company/ RTA or Depository to cast the

ote(s) through remote e-voting before the AGM or through e-votin

Mr. Rupesh Agarwal, Practicing Company Secretary, (Membership N ACS 16302), failing him Mr. Shashikant Tiwari (Membership No. FCS 11919) Partner(s) M/s. Chandrasekaran Associates, Company Secretaries, have been appointed as the Scrutinizer to scrutinize the emote e-voting process before and during the AGM in a fair an

The result of the remote e-voting before and during the AGM shall be declared not later than 48 hours from the conclusion of the AGM. The results declared along with Scrutinizer's Report will be placed on th Company's website <u>www.blblimited.com</u> and on website of NSDL <u>www.evoting.nsdl.com</u> and website of Stock Exchanges i.e. National Stock Exchange of India Limited (NSE) and BSE Limited (BSE) at www.nseindia.com and www.bseindia.com respectively.

Place: New Delhi

## Notice for loss of Shares Certificate of

(for claim from IEPF Authority)

Notice is hereby given that the following share certificate(s) of TVS Motor Company Limited has/ have been lost or misplaced or stolen and registered holder / legal heir is/are in the process of applying to Investor Education and Protection Fund (IEPF) Authority for refund or

the shares and dividends transferred to IEPF.					
Folio No.			Share Certificate	Distinctive Nos.	
		Shares	No(s).	From	To
A2645	ARJUN LEKHRAJ MALKANI	1000			3715670
	VINDRI LEKHRAJ MALKANI	1000	19635	242300391	242301390

his notice is being issued as per Schedule III of the Investor Education and protection Fund

Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2017, as amended from time t

The public are hereby warned against purchasing or dealing in any way with the above shar pertificates. Any person(s) who has/have any claim in respect of the said share certificates, should lodge such claim with evidence to the Company, at its Registered Office, M/s TV3 Motor Company Limited, "Chaitanya", No.12, Khader Nawaz Khan Road, Nungambakkam Chennai – 600006 (email id: contactus@tvsmotor.com) or to its Share Transfer Agents ntegrated Registry Management Services Private Limited, "Kences Towers", 2nd Floor, No. Ramakrishna Street, North Usman Road, T Nagar, Chennai – 600017, (email id rirams@integratedindia.in) within 15 days of publication of this notice, after which no clain

vill be entertained and legal heir(s) of the registered holder will apply to IEPF for refund o

shares and dividends. Any person dealing with the above said shares will be doing so at the

Poonam Chandrakant Jagasia (alias Poonam Ram Shahani Ameet Towers, Flat No. 802, Plot No. 1, Sindhi Soc. Chembur, Mumbai, Maharashtra-40007

**SRM ENERGY LIMITED** SRM Energy

Place : Mumbai

Date: 02-09-2023

CIN L17100DL1985PLC303047 Regd. Office: 21, Basant Lok Complex, Vasant Vihar, New Delhi-110057 Tel. No. 011-41403205 | Website: www.srmenergy.in | Email: info@srmenergy.in NOTICE

otice is hereby given that the 36th Annual General Meeting ("AGM") of the members of SRM nergy Limited ("the Company") will be held on Thursday, 28th September, 2023 at 09:00 .M. at Dolly Farms & Resorts, 439, Village Shahoorpur, P.O. Fatehpur Beri, New Delhi-10074, to transact the business that will be set forth in the Notice of the AGM.

n compliance with the applicable provisions of the Companies Act, 2013 and Rules made nereunder and Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure lequirements) Regulations, 2015 (SEBI LODR) read with General Circular Nos. 20/2020 ated May 05, 2020, General Circular No. 14/2020 dated April 08, 2020 and General Circula io. 17/2020 dated April 13, 2020 and General Circular No.10/2022 dated 28th December 022 ("MCA Circulars") issued by the Ministry of Corporate Affairs ("MCA") and Securities and schange Board of India ("SEBI") vide its Circulars numbers SEBI/HO/CFD/CMD1/CIR/P, 020/79 dated May 12, 2020 and SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 dated January 05, 2023 ("SEBI Circulars") (hereinafter collectively referred to as "the Circulars"), the Notice of the KGM along with the Annual Report for the FY 2022-23 will be sent only through electronic node to all those Members whose email addresses are registered with the Company/Registrar & Share and Transfer Agent/Depository Participant(s). The aforesaid documents will also be vailable on the Company's website at www.srmenergy.com, website of the stock exchange.

BSE Limited at www.bseindia.com and website of the CDSL at www.evotingindia.com fembers who have not registered their email addresses are requested to register the sam ou may please follow below instructions for registering /updating your email addresses:

Members holding shares in physical form are hereby notified that pursuant to General Circular No. SEBI/HO/MIRSD/MIRSD-POD-1/P/CIR/2023/37 dated March 16, 2023, all the holders of physical shares can update/register their contact details including details of email ids by submitting the requisite Form ISR-1 along with supporting documents with MCS Share Transfer Agent Limited either by email to helpdeskdelhi@mcsregistrars.com or by post to MCS Share Transfer Agent Limited at F-65, 1st Floor, Okhla Industrial Area, Phase-1, New Delhi - 110020 Demat Please contact your depository participants and register your email addresses

he Company will be providing the facility to all its members to cast their votes by electron

as per the process advised by your DP.

Detailed procedure for remote -voting for Members holding shares in dematerialized mode, physical mode and for Members who have not registered their email address is provided in the Notice of the AGM. In case of queries or grievances pertaining to e-voting, members are requested to contact Mr. Rakesh Dalvi, Sr. Manager, (CDSL) Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or send an email to helpdesk.evoting@cdslindia.com or call at toll free no. 1800 22 55 33.

Notice is further given that pursuant to Section 91 of the Companies Act, 2013 and Regulation 42 of the SEBI LODR, the Register of Members and Share Transfer books of the Company will remain closed from Friday, September 22, 2023 to Thursday, September 28, 2023 (bot days inclusive) during which no transfer of shares will be registered.

This advertisement is being issued for the information and benefit of all the members of the Company in compliance with the MCA Circulars and SEBI Circulars. For: SRM Energy Limited

(Pankaj Gupta) Place: New Delhi Date: 31.08.2023 Company Secretary

## **GREEN POWER SUGARS LIMITED**

CIN: U15421PN2006PLC022248

Regd Office: Gat No. 959, 960, 961, A/P. Hingangaon BK, Taluka Kadegaon, Sangli- 415305. **E-mail Id** - gpsl555@gmail.com / gpslfin@gmail.com Contact No.: 02161-286333 / 286555 Website: www.greenpowersugars.com

NOTICE OF THE 18<sup>™</sup> ANNUAL GENERAL MEETING AND REMOTE E-VOTING INFORMATION Notice is hereby given that the 18th Annual General Meeting (AGM) of Green Power Sugars Limited ("the Company") will be held on Saturday, the

30th day of September, 2023 at 02:30 p.m. at its Registered Office at Gat No. 959,

960, 961, A/P. Hingangaon BK, Taluka Kadegaon Sangli- 415305, to transac the businesses, as set out in the Notice convening the AGM. The copy of the Notice of the AGM and instruction for remote e-voting, along with attendance slip, proxy form and Annual Report for the financial year 2022-23 has been sent to all the Members at their address registered with the Company, in the

permitted mode. Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013, read with the Rules made thereunder, Secretarial Standard-2 (SS-2) on "General Meeting", issued by the Council of the Institute of Company Secretaries of India (including any statutory modification(s) or re-enactment thereof for the time being in force) the Company is pleased to provide to its Members the facility to cast their votes by electronic means on all resolutions set forth in the notice convening the AGM. The Members may cast their votes using an e-voting system from a place other than the venue of the Meeting (remote e-voting). The Company has engaged National Securities Depository Limited (NSDL) to provide remote e-voting facility. The details of remote e-voting facility pursuant to the provisions of the Companies Act,

- 2013 and Rules made thereunder are: 1. Date of completion of dispatch of Notice of AGM: 2<sup>nd</sup> September, 2023
- 2. The remote e-voting period will commence on Tuesday, 26th September, 2023 at 9.00 a.m. 3. The remote e-voting period will end on Friday, 29th September, 2023 at
- 5.00 p.m. 4. The remote e-voting shall not be allowed beyond 5.00 p.m. on 29th September, 2023.
- Saturday, 23rd September, 2023. 6. Any person, who becomes Member of the Company after dispatch of the Notice of AGM and holding shares as of the cut-off date i.e. Saturday, 23rd September, 2023, may obtain the User ID and Password for remote e-voting by sending a request at <a href="mailto:evoting@nsdl.co.in">evoting@nsdl.co.in</a> or at

5. Cut off day as on which the right of voting of the Members shall be reckoned:

- gpsl555@gmail.com 7. The facility of voting through Polling / Ballot Paper shall be made available at the AGM to the Members who have not casted their vote through remote
- In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Members and remote e-voting user manual for Members available in the download section of www.evoting.nsdl.com or call on toll free no. 1800-1020-990.
- 9. Members may participate in the AGM even after casting their vote through remote e-voting but shall not be allowed to vote again at the AGM. Kindly note that vote once casted cannot be modified. 10. Please note that a Member whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners, as on Saturday

23rd September, 2023, only shall be entitled to avail the facility of remote

e-voting or voting at the AGM through Polling / Ballot Paper, for resolutions set out in the Notice A Member can opt for only one mode of voting i.e. either through remote e-voting or through Polling / Ballot Paper at the AGM. If Member casts his / her votes by both modes, then voting done through remote e-voting shall prevail and the Polling / Ballot Paper shall be treated as invalid. Please read the instructions given n the notes to the notice of the AGM carefully before voting electronically. Any

person who is not a Member as on the cutoff date should treat this notice for information purpose only. The Company has appointed Mr. Vishvas Bokil Company Secretary as the Scrutinizer to scrutinize remote e-voting process and voting at the AGM in a fair

and transparent manner The notice of the AGM shall be available on the NSDL website <u>https://www.evoting.nsdl.com</u> and on the Company's website www.greenpowersugars.com

Members holding shares in physical form, whose email addresses are not registered with the Company, may register their email address, by providing Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back) PAN (self attested scanned copy of PAN card), AADHAR (self attested scanned copy of Aadhar Card) to the email address of the Company at gpsl555@gmail.com.

A Member having query / grievance pertaining to e-voting process can write to Mr. Hanamantrao Shamrao Jadhay Chief Financial Officer, at the Registered Office of the Company or contact him on 7745817111 or send email to gpsl555@gmail.com

For Green Power Sugars Limited

Ashok Anandarao Mulik Managing Director DIN 08421327 Po - Shalgaon, Taluka- Kadegaon,

Shalgaon, Sangli- 415304

Date: 02/09/2023

Place: Kadegaon, Sangli

Ahmedabad

NOTICE OF 09<sup>™</sup> ANNUAL GENERAL MEETING AND E -VOTING INFORMATION

NOTICE is hereby given that the Ninth (09th) Annual General Meeting (AGM) of the Company will be held on Friday, 29th September, 2023 at 11.00 A.M through \_imited (NDSL) at www.evoting.nsdl.com

Companies (Management and Administration) Rules, 2014, as amended and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015, the Shareholders are provided with the facility to cast their votes on all the resolutions as set forth in the Notice onvening the AGM using electronic voting system ('Remote e-voting') provided by held by them in the paid-up equity share capital of the Company as on Friday, 22nd September, 2023 ('cut-off date').

their votes again.

sending a request to evoting@nsdl.co.in However, if he/she is already registered with NDSL for remote e-voting, then he/she can use his/her existing User ID and password for casting the votes. In case of any queries pertaining to e-voting, Shareholders may refer to the

ww.solex.in, NSDL at www.evoting.nsdl.com/, and National Stock Exchange For Solex Energy Limited sd/-

CIN: L67120DL1981PLC354823
Regd. Office: H. No. 4760-61/23, 3rd Floor, Ansari Road,
Daryaganj, New Delhi-110002
Website: www.blblimited.com: Email: infoblb@blblimited.com:
Tel: 011-49325600

transact the businesses as set out in the houte of the 42<sup>--</sup> AGM, in compliance with the applicable provisions of the Companies Act, 2013 rules made thereunder and SEBI (LODR) Regulations, 2015 reac with General Circular No. 14/2020 dated April 8, 2020, No. 17/2020 dated April 3, 2020, No. 20/2020 dated May 5, 2020, No. 20/2021 dated January 13, 2021, No. 20/2022 dated May 5, 2022 and No. 10/2022 dated December 28, 2022 issued by the Ministry of Corporat

requirement of physical attendance of members has been dispensed with. Accordingly, the facility for appointment of proxies by the members will not be available for this AGM. The Notice of 42<sup>nd</sup> AGM and Annual Report of the Company for the

was completed on August 31, 2023. The aforesaid documents are available on the website of the Company i.e. www.blblimited.com and may also be accessed from the websites of Stock Exchanges i.e National Stock Exchange of India Limited (NSE) and BSE Limited (BSE) at <u>www.nseindia.com</u> and <u>www.bseindia.com</u> respectively. The AGM notice is also available on the website of National Securities Depositories Limited (NSDL) at www.evoting.nsdl.com. mote F-voting

Pursuant to Section 108 of Companies Act, 2013 (Act) read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, Regulation 44 of SEBI (LODR) Regulations, 2015 and the Secretarial Standard on General Meetings ("Sc-2") issued by the Institute of Company Secretaries of India, each as amended from time to time, the Company is providing to its Members, the facility of remote e-voting before the AGM and during the AGM in respect of the

The detailed instructions for e-voting and joining through VC/ OVAN are given in the Notice of  $42^{\rm nd}$  AGM. Members are requested to carefully go through the instructions before casting their vote through e-voting

- voting before/ during the AGM Any person who acquires shares and becomes a Member of the Company after the dispatch of the Notice of AGM and holds shares as of the cut-off date i.e. September 19, 2023, may obtain the login ID and password for remote e-voting by sending a request
- resolution, the member shall not be allowed to change i Detailed instructions for remote e-voting, joining the AGM an

Members holding shares in physical mode are hereby notified that ursuant to General Circular No. SEBI/HO/MIRSD/MIRSD-PoD-1/F IR/2023/37 dated March 16, 2023, all holders of physical securiti

ransparent manner.

Nishant Garuc Date: September 1, 2023 Company Secretary

# એક વર્ષથી ધમધમતા જુગારના અજ્ઞા પર દરોડો પકેડેચા, આઠ વાન્ટેડ જાહેર કરાયા આવી હતી. જેનો સમયગાળો પૂર્ણ કરાવ્યા બાદ કરીથી તેને ભાડાપકે નિડેયાદ નગરપાલિકાના પૂર્વ પટેલ નામના આરોપીની ધરપકડ બને તેવી માંગ કરી હતી. જે બાબત થતા પાલિકા દ્વારા આજે એકાએક આપવાની કાર્યવાહી હાથ ધરવામાં પ્રમુખ સંજય ભાસ્કરભાઈ દેસાઈ કરવામાં આવી હતી. આ જમીન અનુસંધાન બીજે પાને)

આવેલા એક ઝૂંપડામાં છેલ્લા એક વર્ષથી ધમધમતા | ૨૩ આરોપીઓ સામે નડિયાદ ટાઉન પોલીસ મથકે | મામલે દુકાનદારો પાલિકા ભવને | મામલો થાળે પડ્યો હતો. જુગારના અકા ઉપર ગુરૂવારે મોડી સાંજે સ્ટેટ ફરિયાદ નોંધાવી મામલાની તપાસ નડિયાદ પશ્ચિમ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો. એસ.એમ.સી.ના પોલીસને સોંપવામાં આવી છે.

નડિયાદ, તા.૧<sub>ા</sub> દરોડામાં ૧૫ જુગારીઓની અટક કરવામાં આવી દુકાનદારોને દુકાનો ખાલી કરવાનું આવશે તેવી બાહેધારી ચીફ નડિયાદ શહેરમાં અમદાવાદી બજાર વિસ્તારમાં હતી, જ્યારે આઠ આરોપીઓ વોન્ટેડ છે. જે તમામ કરમાન કરવામાં આવ્યું હતું. જે ઓફિસર દ્વારા આપવામાં આવતા

# સ્ટેટ મોનિટરિંગ સેલે ૨૩ સામે ગુનો નોંધાવ્યો નડિયાદમાં રખડતા ઢોરે શિંગડે

સેલની ટીમને મળતાં બાતમીની | લીધો હતો. ખરાઈ કર્યા બાદ ગુરૂવારે મોડી સાંજે | પોલીસની દરોડો કરવામાં આવ્યો હતો. જેમાં | પૂછપરછમાં છેલ્લા એક વર્ષથી | મલેકસામે પણ પોલીસે ગુનો દાખલ |

નડિયાદના અમદાવાદી દરવાજા | ઝડપાઈ ગયા હતા, જ્યારે આઠ | અમન અહમદહુસેન મલેક ધમધમતો હતો. જેની માહિતી તેમજ વાહનો મળી કુલ રૂ. ટિફિન, ઈરફાનકાજી, મહેબૂબઅને ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ | ૨,૨૪,૮૯૦ નો મુદ્દામાલ કબજે | આસિફ બટુકને રોજમદાર તરીકે |

જુગાર રમી રહેલા ૧૫ શખ્સો | દિનેશ ઉર્ફે દિનશા પ્રજાપતિ અને |

પ્રાથમિક | પૂરી પાડનારા ઇનાયત ઉસ્માનભાઈ | (અનુસંધાન ત્રીજે પાને)

# <u>પોલીસે કુલ ૭૮ હજારની રોકડ જપ્ત કરી</u> મહેમદાવાદ તથા નડિયાદમાંથી જુગાર જુગારિયાઓ ઝડપાયા અને હજુ તેણી કાંઈ સમજે તે પહેલા જતેમને અડફેટેલઈને શીંગડે ચડાવી

ખેડા જિલ્લામાં શ્રાવણીયા જુગાર ઠેર ઠેર ધમધમી મહેમદાવાદ પોલીસ પેટ્રોલિંગમાં નીકળેલ હતી. આ હિતા. રહ્યો છે. ત્યારે નડિયાદ તેમજ મહેમદાવાદ પોલીસે દરમિયાન હલઘરવાસ ચરા વિસ્તારમાં કેટલાક ઈસમો જૂગારના દરોડા પાડી ૧૮ જૂગારીયાઓને કુલ પત્તાપાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે.

નાડિયાદ, તા.૧ | રૂ.૭૮,૧૫૦ રોકડ સાથે ઝડપી પાડયા હતા. ઉછાળતા તેઓ માર્ગ ઉપર પટકાયા ખિસેડ્યા હતા. જ્યાં હાલમાં તેઓની ચર્ચાઓ વચ્ચે અનેક બિલ્ડરોની ડી.એસ. ગઢવી સાથે કોઈક બાબતે કસાવવા માટે બે યુવતીનો સંપર્ક

## શ્રાવિશયા જૂગારની ભારે બોલબાલા વચ્ચે આખરે પોલીસ દોડતી થઇ

બાતમી મળતા પોલીસે દરોડો 1 કર્યો હતો. પાડી આયુશકુમાર ઉર્ફે મોદી | આ ઉપરાંત મહેમદાવાદના હતા. કલ્પેશભાઇ શાહ, અર્જૂનભાઇ માંકવા બારીયાવગા વિસ્તારમાં મંગાભાઇ ઝાલા, કલ્પેશકુમાર ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર મહેમદાવાદ વડવાળા કુવા પાસે ભરતભાઇ ઝાલા, ભીખાભાઇ | રેઈડ કરતા સુરેશભાઈ ઉર્ફે મનુભાઈ | પત્તાપાનાનો હારજીતનો જુગાર રમે દોલાભાઇ ખાંટ, મેલાભાઇ હોથાભાઈ ચૌહાણ, ગણપતભાઈ છે. જેબાતમી આધારે પોલીસે દરોડો કાળાભાઇ ઝાલાને ઝડપી પાડી |કાળાભાઈ ચૌહાણ, સંજયભાઈ |પાડી સાગરભાઈ જેસંગભાઈ અંગજડતી તથા દાવપરની રકમ મળી | કાનજીભાઈ ચૌહાણને ઝડપી પાડી | પરમાર, રાજેશભાઈ ઉર્ફે રાજુ

કુલ રૂ.૧૮,૪૫૦ નો મુદ્દામાલ કબજે | દાવપરથી તથા અંગજડતીમાંથી મળી |

ાકુલ રોકડ રૂ.૩,૧૦૦ કબજે કર્યા

જ્યારે બીજા બનાવમાં (અનુસંધાન ત્રીજે પાને)

## <u>શ્રાવિણયા જુગારની બદી વકરી</u> બોરસદ, પરવટા અને કણભામાંથી પોલીસ દ્વારા દસ્તાવેજોની અલા ચકાસણી હાથ ધરાઇ ૧૫ જૂગારી ઝડપાયા, પાંચ ફરાર

આશંદ, તા.૧ ૄ૧૫ શખ્સો ઝડપાયા હતા. જ્યારે પાંચ શખ્સો નાસી તેમના મળતીયાઓ દ્વારા આચરવામાં દરમિયાન હેતુલ પટેલે અનેક તોરણા માતા સીમ કાલોરમાતા શ્રાવણ માસમાં આણંદ જિલ્લામાં જુગારની બદી ગયાહતા. આ ત્રણ અલગ અલગ બનાવો અંગે બોરસદ, આવેલા જમીન કૌભાંડ મામલે હાલમાં દસ્તાવેજો ઉપર સાક્ષી તરીકે સહી કરી વિષેદર સામે વોચમાં ગોઠવાઈ ગઈ ફુલીફાલી છે. વિતેલા દિવસો દરમ્યાન બોરસદ, પરવટા ઉમરેઠ અને વીરસદ પોલીસે તમામ શખ્સો વિરુધ્ધ પોલીસ તપાસ કરી રહી છે. સંજય હોવાની કબુલાત કરી છે. જેના આધારે હિતી. અને કણભામાંથી પાના પત્તાનો હારજીતનો જુગાર રમતા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોરસદ-પામોલ રોડ ઉપરા આવેલા બડઝાંખલાના કુવા નજીક | કુચબંદિયા, પરમેશ્વર ઈશ્વરભાઈ | પોલીસને મળી હતી. જેથી પોલીસે કેટલાક શખ્સો એકત્ર થઈ જુગાર | કુચબંદિયા, નરેશભાઈ સંદેશભાઈ | બાતમીવાળા સ્થળે છાપો મારતા રમી રહ્યા હોવાની બાતમી બોરસદ | કુચબંદિયા, અરૂણ વાંસફોડિયા અને | જુગાર રમતા હીતેશભાઈ શનાભાઈ | પોલીસને મળી હતી. જેથી પોલીસે | પસાભાઈ ઘટના સ્થળેથી ફરાર થઈ | રાઠોડ, પરવતભાઈ ઉર્ફે ગરોળી | જુગાર રમતા અનિલભાઈ કબજે કર્યો હતો. પૂનમભાઈ કુચબંદિયા અને સુનિલભાઈ કુચબંદિયાને ઝડપી પાડ્યા હતા. પત્તાનો હારજીતનો જુગાર રમાઈ

મંગળભાઈ | ગામના આથમણા ફળિયામાં પાના | ચંદુભાઈ રાઠોડ, ગણપતભાઈ

જો કે દિનેશભાઈ ઈશ્વરભાઈ | રહ્યો હોવાની બાતમી ઉમરેઠ તેમજ ઉમરેઠ તાલુકાના પરવટા | ૨ઈજીભાઈ જાદવ, દિનેશભાઈ |

(અનુસંધાન ત્રીજે પાને)

# બે જણાને બચકા ભય<u>ા</u>ં હતા निरेयाह वाशियावाउ विस्तारमांथी નડિયાદ, તા.૧ | વ્યાપી ગયો છે. ત્યારે નડિયાદ વર્ન વિભાગની ટીમે

પાંજરું ગોઠવી તોફાની વાનરને ઝડપી પાડ્યો હતો. નડિયાદ વાણીયાવાડ વિસ્તારમાં તોફાની કપિરાજે બે ઇસમોને બચકા ભરતાં સ્થાનિક રહીશોમાં ફફડાટ જેથી સ્થાનિક રહીશોએ રાહત અનુભવી છે.

જંગલ સીમ વિસ્તારમાં જોવા મળતા હોય છે ત્યારે આડેધડ વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે. જેના પગલે વાનર જેવા પશુઓ ખોરાકની શોધમાં રહેણાક વિસ્તારમાં આવી રહુયા છે. આવી જ રીતે નડિયાદ શહેરની સોસાયટીઓમાં વાનરોના ટોળેટોળાં ઉમટી રહ્યા છે. નડિયાદ વાણીયાવાડ



વિસ્તારની સોસાયટીમાં છેલ્લા થોડા દિવસથી સરગમ પાર્ક સોસાયટી સહિત આજુબાજુના વિસ્તારમાં હુમલો કરવાના બનાવો બની રહ્યા બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. (અનુસંધાન ત્રીજે પાને)

# સંતરામ નિલયમ કોમ્પલેક્ષની દુકાનો ખાલી કરવા ફરમાન

નડિયાદ શહેરના સંતરામ રોડ ઉપર નગરપાલિકા હસ્તકનું સંતરામ નિલયમ કોમ્પ્લેક્સ આવેલું છે. આ કોમ્પ્લેક્સમાં દુકાનદારોને ભાડાપટ્ટે દુકાન આપવામાં આવી હતી. જોકે આજે એકાએક પાલિકાની ટીમ દ્વારા દુકાનદારોને દુકાનો ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. જેને લઈને દુકાનદારો દ્વારા પાલિકા કચેરીએ જઈને રજૂઆત કરવામાં આવી હતી. દુકાનો ખાલી કરાવ્યા બાદ ફરીથી કરાર

નડિયાદ શહેરના હાર્દસમા પહોંચ્યા હતા અને આ મામલે સંતરામ રોડ ઉપર સંતરામ નિલયમ | રજૂઆત કરી હતી. કોમ્પ્લેક્સ આવેલું છે. આ કોમ્પ્લેક્સ

દુકાનદારો દ્વારા ભાડા કરાર નડિયાદ નગરપાલિકા હસ્તક છે. રીન્યુ કરી આપવાની રજૂઆત કોમ્પ્લેક્સમાં દુકાનદારો દ્વારા કરાર કરવામાં આવી હતી. જો કે, હસ્તક ભાડાપટ્ટે દુકાનો લેવામાં નિયમાનુસારએકવાર દુકાનો ખાલી

# માઈ મંદિર ગરનાળા પોસેની ઘટના

છેલ્લા એક વર્ષથી જુગારનો અક્રો રોકડા રૂ. ૭૭,૩૯૦, ૧૨ મોબાઇલ વોચ રાખવા માટે યાસીન ઉર્ફે તેમને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજા થઈ હતી.

## મહિલાને હોસ્પિટલ ખસેડાઇ : તંત્ર મુકપ્રેક્ષક રાખવામાં આવ્યા હતા. ત્યાં લાઈટ હોવાનો આક્ષેપ રોષે ભરાયેલા લોકોએ ઠાલવ્યો

નડિયાદમાં રહેતાં નજમાબેન | શુક્રવારે શાક માર્કેટમાંથી શાક લઈને તેમના એક પરિચિત સાથે બાઈક | ઉપર ઘર તરફ જઈ રહ્યા હતા. આ સમયે માઈ મંદિર ગરનાળા પાસે રખડતા પશુઓનું ઝુંડ ઊભું હોવાથી 🚦 તેઓ અટક્ચા હતા. ત્યારે પશુઓના ઝુંડમાંથી એક આખલો એકાએક નજમાબેન તરફ દોડીને આવ્યો હતો અને હજુ તેણી કાંઈ સમજે તે પહેલા

જેના કારણે તેમને માથાના રહ્યું છે. ભાગે અને શરીરના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ઘટનાને પગલે આસપાસ ઠલવાતા કચરાને કારણે નડિયાદની ખાનગી હોસ્પિટલમાં

હાલત ગંભીર હોવાનું જાણવા મળી માઈ મંદિર ગરનાળાની

## (અનુસંધાન ત્રીજે પાને) તપાસ કલેક્ટર કચેરી સુધી પહોંચી મેંગાભાઈ ઝાલા, કલ્પેશકુમાર ખુલી જગ્યામાં કેટલાક લોકો જુગાર મહેમદાવાદ વડવાળા કુવા પાસ ભેમસિંહ ઝાલા, મહેન્દ્રભાઇ રમે છે. જે બાતમી આધારે પોલીસે ખુલી જગ્યામાં કેટલાક ઈસમો નડિયાદ જમીન કોભાડમાં હેતુલ

નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા આચરવામાં આવેલા જમીન થશે. પોલીસ દ્વારા હેતુલ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જોકે આ સમગ્ર મામલાની તપાસ હાલમાં કલેકટર કચેરીમાં પહોંચી છે. પોલીસ

તપાસમાં અનેક ખુલાસા થવાની શક્યતા વ નડિયાદ નગરપાલિકાના પૂર્વ અનેતેનેકોર્ટમાં રજૂકરી ત્રણ દિવસના સર્વેની જમીન પચાવી પાડવામાં આવી હોવાનું ઘ્યાને આવ્યા બાદ આ મામલે પોલીસે હેતુલ પટેલની અટક કરી હતી

પ્રમુખસંજયભાસ્કરભાઈદેસાઈતેમજ રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ બાયપાસ હાઈવે રોડ ઉપર આવેલી ભાસ્કરભાઈ દેસાઈ દ્વારા ચકલાસી હવે પોલીસ કલેકટર કચેરીમાં હેતુલ પટેલ અને શાહબાઝ મલેકની સાક્ષી તરીકે સહી હોય તે તમામ દસ્તાવેજોની પોલીસ ફરિયાદ થઈ હતી. જે મામલે ચકાસણી કરશે. આ તપાસ દરમિયાન (અનુસંધાન બીજે પાને)

# છેતરપિંડી થયા અંગે મહુધા પોલીસ મથકે ફરિયાદ બાતમીવાળા સ્થળે છાપો મારી ગયા હતા. પોલીસે રૂા.૧,૦૭૦ જીગાભાઈ રાઠોડ, કમલેશભાઈ સુવાર રમતા અનિલભાઈ કબજે કર્યો હતો. શનાભાઈ રાઠોડ, મનુભાઈ મીનાવાડાના ઇસમન લાલચ આપી સાધુ ગાડી લઈ જઈ છૂમંતર

કહી ગાડી લઈ જઈ પરત ન આપી ઠગાઈ કરી હતી. કાર્યવાહી હાથ ધરી હતી.

મહુધા તાલુકાના મીનાવાડાના ઈસમને એક આમ સાધુનો સ્વાંગ રચી ગઠિયાએ ગાડી લઇ જઈ સાધુએ રૂપિયા જોઈતા હોય તો લઈ જજે કહી ડાકોર મીનાવાડાના ગાડીના માલિક સાથે વિશ્વાસ ઘાત ગૌશાળા માટે જમીન શોધવા ગાડીની જરૂર હોવાનું છે. આ અંગે મહુધા પોલીસે ગુનો નોંધી કાયદેસર

## આશ્રમ-ગૌશાળા માટે જમીન શોધવા ગાડીની જરૂર હોવાનું કહી ગાડી લઈ ગયો હતો

મહુધા તાલુકાના મીનાવાડામાં 1 આશ્રમમાં દાન કરવા માંગે છે.

રહેતા અમિતકુમાર જગદીશકુમાર બનાવવા અલીણા ચોકડી થી ડાકોર આપી હતી. શર્મા કઠલાલમાં હેર કટીંગની દુકાન | રોડ વિસ્તારમાં ૨૦૦ વીઘા જેટલી હતા. જ્યાં તેઓએ સાધુની

તેઓ આશ્રમ તેમજ ગૌશાળા | પ્રદીપગીરી મહારાજ તરીકે ઓળખ

તેઓએ કઠલાલમાં ગાડીઓ ચલાવી ગુજરાત ચલાવે છે. તેઓએ જિમીન શોધે છે. આ માટે તેઓને જોતા પસંદ ન આવતા પરત ગયા તોફાની બનેલા કપિરાજ લોકો પર તા.૨૬/૮/૨૩ના રોજ અમિત શર્મા આપવાની હોય કે તમારી પાસે ગાડી રાત્રે ફોન કરી અમિત શર્માને હુમલો કરવાના બનાવો બની રહ્યા પર ઉદેશી પરમાર (રહે.કંજોડા) ના હોય તો જણાવજો જેથી તેઓએ જણાવેલ કે હું ડાકોર દંડી આશ્રમમાં છેં. તોફાની વાનરના આતંકથી મિત્રએ ફોન કરીને જણાવેલકે મારા કઠલાલમાં ઘણા ડીલરો છે તેમ કહેતા રોકાયો છું તારે રૂપિયાની જરૂર હોય સોસાયટી વિસ્તારના લોકો ઘરની મિત્ર વિજયસિંહસોઢા (રહે. અંધારી ઉદેસિંહ પરમાર સાધુને લઈને તો લઈ જજે જેથી અમિત શર્મા બીજા આંબલી) ના એક પરિચિત સાધુ કઠલાલ હેર કટીંગની દુકાને ગયા દિવસે ડાકોર દંડી આશ્રમ જતા (અનુસંધાન ત્રીજે પાને)

સમગ્ર મામલે ભીનું સંકેલવાનો પ્રયાસ નાડેયાદ જમીન કોભાંડ મામલે નડિયાદ, તા.૧ | અને તેમના મળતીયાઓ દ્વારા

ઊભા થયા છે.

નડિયાદ નગરપાલિકાના પૂર્વ બનાવટી દસ્તાવેજો, બોગસ પ્રમુખ અને ચારુસેટ યુનિવ સટીના આધારકાર્ડ, બોગસ પાવર ઓફ સભ્ય દ્વારા આચરવામાં આવેલા એટર્ની સહિતના દસ્તાવેજો તૈયાર જમીન કૌભાંડ મામલે તંત્રની કરીને જમીન કૌભાંડો આચર્યા હતા. કામગીરી સામે સવાલો ઊભા થઈ 🛭 જે બાબતે શ્વેતલભાઇ પટેલ દ્વારા રહ્યા છે. એક તરફ પોલીસે ફરિયાદ અરજી કરવામાં આવ્યા બાદ થયાના ૨૮ દિવસ બાદ એક કલેક્ટર કચેરીમાંથી તેમને પોલીસ આરોપીની ધરપકડ કરી હતી, તો | ફરિયાદ નોંધાવવાનું કહેવામાં આવ્યું બીજી તરફ એસ.આઇ.ટી. ની હતું. જેને પગલે તેઓએ પહેલી બિઠક જ ન મળતાં સમગ્ર મામલે ઓગસ્ટના રોજ ચકલાસી પોલીસ તંત્રની કામગીરી સામે પણ સવાલો વશકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ૨૮ દિવસ બાદ પોલીસ દ્વારા હેતુલ

કોભાંડ ઉપરાંત અન્ય બે જમીન કૌભાંડો મામલે પણ શ્વેતલભાઇએ કલેકટર કચેરીના સંબંધિત વિભાગમાં અરજી કરી હતી. જેમાં તેઓએ અન્ય જિલ્લામાં જમીન કૌભાંડ મામલે નનામી અરજી થઈ હોવા છતાં પણ તેને ગંભીરતાથી લઈને તે જિલ્લાના સ્થાનિક તંત્ર દ્વારા આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનો ઉક્ષેખ કર્યો હતો અને ખેડા જિલ્લાના બંને જમીન કૌભાંડમાં પણ તંત્ર જ ફરિયાદી બને તેવી માંગ કરી હતી. જે બાબતે

નિનામી અરજીના આધારે જો અન્ય જિલ્લામાં તંત્ર ફરિયાદી બની શકતું હોય તો ખેડા જિલ્લામાં કેમ નહીં ? : અરજદાર

## આશંદના તત્કાલિન કલેક્ટરના ક્લિપકાંડમાં ખુલાસો સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ચડાવતા મહિલાને ગંભીર ઈજા મોબાઇલ ચાર્જરના આકારનો ગુપ્ત કેમેરો બહાર ઉસ્માનભાઈની ચાલીના પ્રિમોને વોન્ટેડ જાહેર કરવામાં ભાગીદારીમાં આ જુગારનો અક્રો પાછળના ભાગે આવેલા ઝૂંપડામાં છેલ્લા એક વર્ષથી જગારનો અક્રો રોક્શ ર ૧૦૦ ૧૦ મોહાહલ વોચ રાખવા માટે યાગીન ઉર્દે તેના તેઓ જમીન ઉપર પટકાતાં રેને મહિલાને આખલાએ અડફેટે લેતાં તેઓ જમીન ઉપર પટકાતાં રેને પ્રાપ્ત લાવતા હતા. અક્રાની આસપાસ વોચ રાખવા માટે યાગીન ઉર્દે રેને મહિલાને આખલાએ અડફેટે લેતાં તેઓ જમીન ઉપર પટકાતાં રેને પ્રાપ્ત લાવતા હતા. અક્રાની આસપાસ વોચ રાખવા માટે યાગીન ઉર્દે રેને મહિલાને આખલાએ અડફેટે લેતાં તેઓ જમીન ઉપર પટકાતાં રેને પ્રાપ્ત લાવતા હતા. અક્રાની આસપાસ વોચ રાખવા માટે યાગીન ઉર્દે રેને મહિલાને આખલાએ અડફેટે લેતાં તેઓ જમીન ઉપર પટકાતાં રેને પરકાતાં રેને સ્પત્ર પટકાતાં રેને મહિલાને આખલાએ અડફેટે લેતાં તેઓ જમીન ઉપર પટકાતાં રેને સ્પત્ર પ્રાપ્ત પ્રત્ય પ્રત્ય

ટ્રેપમાં ફસાવવા માટે આ ત્રણેય વ્યક્તિઓએ મોબાઈલ<sup>ા</sup> ન હતી.

આણંદના તત્કાલીન કલેક્ટર ડી.એસ. ગઢવીનો ચાર્જરના આકારનો ગુપ્ત કેમેરા સ્વીચબોર્ડના પ્લગમાં આપત્તિજનક વિડીયો વાયરલ કરવાના બનાવમાં પ્લાન્ટ કર્યો હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. પ્રથમ નિવાસી અધિક કલેક્ટર તથા નાયબ મામલતદાર સહિત નજરે જોતા પ્લગમાં મુકાયેલ ચાર્જર રાખ્યું હોવાનું ત્રણ વ્યક્તિઓ હાલ જેલમાં છે. જિલ્લા કલેક્ટરને હની વજરે ચઢતા તત્કાલીન કલેક્ટરને આ બાબતે શંકા ગઈ

## કેમેરામાં એક જ દિવસનું સ્ટોરેજ હોવાથી તેને રોજેરોજ તપાસવામાં આવતો હતો છેલ્લા ઘણા સમયથી કલેક્ટર, જાણવા મળ્યું છે. તેઓની સાથે | છૂપી આવકમાં કપાત થતા બંને

કચેરી ખાતે એક જ જગ્યાએ ચીટકેલ | નિવાસી અધિક કલેક્ટર કેતકી વ્યાસ | રઘવાયા થયા હતા અને ડી.એસ. નાયબ મામલતદાર જે.ડી. પટેલ અને જે.ડી.ના વકીલ મિત્ર હરીશ ગઢવીને હની ટ્રેપમાં ફસાવવાનો જમીનોની ફાઈલો ક્લીયર ચાવડા પણ બરાબરના ભાગીદાર પ્લાન ઘડ્યો હતો. કરાવવામાં પાવરધો હોવાની હોવાનું ખુલ્યું છે. જો કે કલેક્ટર

વગાડતા ક્લીયર કરાવી હોવાનું જે.ડી. પટેલ અને કેતકી વ્યાસની

ડી.એસ. ગઢવીને હની ટ્રેપમાં ફાઈલો આર્થિક વ્યવહારો થકી ચપટી વાંધો પડતા છેલ્લા કેટલાક સમયથી હરીશ ચાવડાએ કર્યો હતો જ્યારે (અનુસંધાન બીજે પાને)

# બોરસદ હાઈવે પર હેરાફેર<u>ી કરતા</u> અસપાસથી લોકો દોડી આવ્યા હતા અહીં રખડતા પશુઓનો કાયમી અને તુરંત જ આખલાને ભગાડીને અડીંગો જોવા મળે છે. જેને કારણે પક્રિયાય હોને પક્રિયાય હોને વાસનાય હોને हारू साथे जे परप्रांतिय अउपाया

વિદેશી દારૂનો જથ્થો લઈ પસાર થતા બે શખ્સોને <sup>|</sup> છે.

આણંદ, તા.૧ ૃ બોરસદ શહેર પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે બોરસદ બાયપાસ હાઈવે માર્ગ ઉપર તોરણા માતા 🛭 કુલ રૂા.૭.૩૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈ સીમ કાલોરમાતા મંદિર સામેથી પીકઅપ ડાલામાં બિંને શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

## પ,૭૧૨ ક્વાટર સહિત રૂપિયા ૭.૩૧ કૌભાંડમાં સાક્ષી તરીકે સહી કરનાર હેતુલ પટેલના રિમાન્ડ આજે પૂર્ણ લાખનો મુદામાલ કબજે કરી ગુનો નોંધ્યો થશે. પોલીસ દ્વારા હેતલ પટેલને કોર્ટમાં રજ કરવામાં આવશે. જોકે આ

ઉપર થઈ પસાર થનાર હોવાની મળી હતી. જેથી પોલીસની ટીમ

દરમિયાન બાતમીમાં વર્ણવ્યા મુજબનું પીકઅપ ડાલુ આવી ચઢતા ચાલકના નામઠામ અંગે પૂછપરછ કરતા તે શિવકુમાર જગદીશપ્રસાદ

એક બોલેરો પીકઅપડાલુ ગાડી | પાલ (મૂળ રહે.કરમટા, મહાદેવ | રહે.મહારાષ્ટ્ર) જણાવ્યું હતું. વિદેશી દારૂનો જથ્થો ભરી વાસદ મંદિર પાસે, તા.ફુલપુર, ચાલકની બાજુમાં બેઠેલા શખ્સના તરફથી બોરસદ બાયપાસ હાઈવે જિ.પ્રયાગરાજ, યુપી, હાલ (અનુસંધાન ત્રીજે પાને)

## બાતમી બોરસદ શહેર પોલીસને **SOLEX** સોલેક્સ એનર્જી લિમિટેડ

રજીસ્ટર્ડ ઓફિસ : પ્લોટ નં. ૧૩૧/એ, ફેઝ-૧, ક્રિમી ઈન્ડસ્ટ્રીઝ પાસે, જીઆઈડીસી વિર્કલ ઉદ્યોગનગર, આણંદ – ૩૮૮૧૨૧ ફોન : +૯૧ ૨૬૧ ૩૫૫ ૯૯૯૯ ઈ-મેલ : info@solex.in

૦૯ મી વાર્ષિક સામાન્ય સભાની સૂચના અને ઈ-વોટિંગની માહિતી

## આથી સૂચના આપવામાં આવે છે કે કંપનીની નવમી ( oeમી ) વાર્ષિક સામાન્ય સભા (AGM) શુક્રવાર, રલ્મી સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે વિડીયો કોન્ફરન્સ પોલીસે તેને અટકાવ્યું હતું અને ("VC")/અન્ય ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમો ("OAVM") દ્વારા યોજવામાં આવશે. ૦૯મી એજીએમની નોટિસમાં નિર્ધારિત કર્યા મુજબ વ્યવસાયનો વ્યવહાર કરવા, જે એજીએમ બોલાવવા માટે પ્રસારિત કરવામાં આવી રહી છે. કંપનીએ પહેલાથી જ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટેનો વાર્ષિક અહેવાલ ૦૯મી એજીએમ બોલાવવા સૂચના સાથે ઈલેક્ટ્રોનિક મોડ દ્વારા એવા શેરધારકોને મોકલી દીધો છે કે જેમના ઈમેલ એડ્રેસ કોર્પોરેટ બાબતોના મંત્રાલય (MCA) અને સિક્ચોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા જારી કરાચેલા પરિપત્રો અનુસાર કંપની અને/અથવા ડિપોઝિટરીઝમાં નોંધાચેલા છે. ૦૯મી એજીએમની સૂચના સાથેનો વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઇટ www.solex.in પર અને નેશનલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ (NDSL)ની વેબસાઇટ www.evoting.nsdl.com/ પર પણ ઉપલબ્ધ છે .

એજીએમ દરમિયાન રિમોટ ઈ-વોટિંગ અને ઈ-વોટિંગ अधिनियमनी डलम १०८ अने डंपनीज (मेनेक्मेन्ट એन्ड એडमिनिस्ट्रेशन) नियमो ૨૦૧૪ ના નિયમ ૨૦ ની જોગવાઈઓ અનુસાર, સિક્ચોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ્ ઈન્ડિયા (લિસ્ટિંગ ઓબ્લિગેશન અને ડિસ્ક્લોઝર જરૂરીયાતો) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ ના સુધારેલા અને નિયમન ૪૪ મુજબ શેરધારકોને NSDL દ્વારા પૂરી પાડવામાં આવેલ ઈલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ (''રિમોટ ઈ-વોટિંગ'') નો ઉપયોગ કરીને એજીએમ બોલાવતી નોટિસમાં દર્શાવ્યા મુજબના તમામ ઠરાવો પર તેમનો મત આપવાની સુવિદ્યા પૂરી પાડવામાં આવે છે. શેરદારકોના મતદાન અધિકારો શુક્રવાર, રસ્મી સપ્ટેમ્બર, ૨૦૨૩ (''કટ-ઓફ તારીખ'') ના રોજ કંપનીની પેઇડ-અપ ઇક્વિટી શેર મૂડીમાં તેમના દ્વારા રાખવામાં આવેલા ઇક્વિટી શેરના પ્રમાણમાં હશે.

રિમોટ ઈ-વોટિંગનો સમયગાળો મંગળવાર, રદ્દમી સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ સવારે ૯:૦૦ કલાકે શરૂ થશે અને ગુરુવાર, ૨૮મી સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ સાંજે ૫:૦૦ વાગ્યે સમાપ્ત થશે. IST. આ સમયગાળા દરમિયાન, શેરધારકો ઇલેક્ટ્રોનિક રીતે તેમનો મત આપી શકે છે. દંડી આશ્રમમાં બોલાવ્યો હતો. બાદમાં આશ્રમ- છેતરપિંડી કર્યાના બનાવે ભારે ચકચાર મચી જવા પામી વિવારબાદ NSDL દ્વારા રિમોટ ઇ- વોટિંગ મોડ્યુલને અક્ષમ કરવામાં આવશે. તે શેરદારકો, જેઓ VC/OAVM સુવિધા દ્વારા ૦૯મી એજીએમમાં હાજર રહેશે અને રિમોટ ઈ-વોટિંગ દ્વારા हरावो पर पोतानो मत आप्यो न हतो अने अन्थथा तेओने आम કरवाथी प्रतिजंधित કરવામાં આવ્યા નથી, તેઓ આ દરમિયાન ઈ-વોટિંગ સિસ્ટમ દ્વારા મત આપવા માટે પાત્ર રહેશે.૦૯મી એજીએમ.એજીએમ પહેલાં રિમોટ ઈ-વોટિંગ દ્વારા તેમના મત મૂકનારા શેરધારકો પણ વીસી/ઓએવીએમ દ્વારા એજીએમમાં હાજરી/ભાગ લઈ શકે છે પરંતુ તેઓ ફરીથી તેમનો મત આપવા માટે હકદાર નથી.

સભ્યોના રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર બુક્સ વર્ષ ૨૦૨૨-૨૩ માટે ડિવિડન્ડ મેળવવા માટે શેરદારકોની હકદારી નક્કી કરવા અને લ્મી વાર્ષિક સામાન્ય સભા ના હેતુ માટે ૨૩/૦૯/૨૦૨૩ થી ૨૯/૦૯/૨૦૨૩ સુધી ( બંને દિવસો સહિત ) બંધ રહેશે .

કોઈપણ વ્યક્તિ, જે કંપનીના શેર હસ્તગત કરે છે અને કંપની દ્વારા ઈલેક્ટ્રોનિક રીતે નોટિસ મોક્ત્યા પછી કંપનીનો શેરહોલ્ડર બને છે અને કટ-ઓફ તારીખે શેર ધરાવે છે; તે evoting@nsdl.co.in પર વિનંતી મોકલીને લોગિન આઈડી અને પાસવર્ડ મેળવી શકે છે. જો કે, જો તે/તેણી પહેલાથી જ રિમોટ ઈ-વોટિંગ માટે NDSL સાથે નોંધાચેલ હોચ, તો તે/તેણી વોટ આપવા માટે તેના/તેણીના હાલના યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી શકે છે. ઈ-वोटिंग संअंधित डोઈपए प्रश्नोना डिस्सामां, शेरधारडो वारंवार पूछाता प्रश्नो લોનથી વેગેનાર કાર લીધી છે. ગાડીની જરૂર છે કોઈને ગાડી હતા. બાદમાં પ્રદીપગીરી મહારાજે ("FAQs") અને મદદ વિભાગ હેઠળ www.evoting.nsdl.com/ પર ઉપલવ્દા ઇ-વોટિંગ મેન્યુઅલ જોઈ શકે છે અથવા ૦૨૨ - ૪૮૮૬ ७००० અને ૦૨૨ - ૨૪૯૯ ७००० પર સંપર્ક કરી

> શકે છે evoting@nsdl.co.in પર વિનંતી મોકલો. AGM ની વિગતો કંપનીની વેબસાઇટ www.solex.in પર, NSDL www.evoting.nsdl.com/ પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડિયા લિમિટેડ www.nseindia.com પર ઉપલબ્ધ છે.

સોલેક્સ એનર્જી લિમિટેડ સહી/-

ક્થળ : આણંદ તારીખ : ૦૨.૦૯.૨૦૨૩

દિલીપકુમાર નિખારે કંપની સેકેટરી એન્ડ કમ્પ્લાયન્સ ઓફીસર